

પ્રકૃષ્ટણ - ૨.

Chapter - 2

તુલનાત્મક સાહિત્ય.

આ શૈક્ષણિકાંગની પદ્ધતિ બિશે કેટલીક અચ્છા આરથે કુરીની અભિયાની હોય હે, કેમકે પદ્ધતિની સ્વભાવતા વિના શૈક્ષણ પણ અસ્વભાવ રહી નથે હે. આ પદ્ધતિ રે "તુલનાત્મક સાહિત્ય", અથવા સાહિત્યના અભ્યાસની તુલનાત્મક પદ્ધતિ.

તુલનાત્મક સાહિત્ય એટલે કું? "તુલનાત્મક સાહિત્ય" - "Comparative literature" - આ સંજ્ઞા માટે વણા વિદ્યામાંને અચ્છી કરી હે. કેન કુપરે તો એ સંજ્ઞાને વાટુકરણની ભૂત ગણાવી જા સંજ્ઞા અર્થશૂન્ય હે એમ કણી તેનો છે ઉદાહરણ દીધો. એ, બિશે વધુ શાખાઓમાં ન પડવા માટે અજકાલ આ વિષયને કેટલાંક વિદ્યામાં "Comparative study of literature" "એમ સંપૂર્ણ રીતે વણીનાત્મક સંજ્ઞાથી અંગારે હે. તેનું જ તુલનાત્મક સાહિત્ય" એ લખુંથ્ય હે એમ રેખો મારે હે.

ભારતીય પ્રસંગમાં આપણે સમાચારોજના કરીને રસો કાઢી રહ્યાના હોવાથી "તુલનાના આધારે કરેલો સાહિત્યનો અભ્યાસ" રે "તુલનાત્મક સાહિત્યાભ્યાસ" એવી યોજના કરવી શક્ય થતી હે, એનું વિશેષ વર્ણન બાપ્યાપ્તનું માનનું હે.

તુલનાત્મક વિશારના અધ્યાર્થી ઈટાલિયન કુનિ ઈટાને મનાય હે. રે પછી ઈટ મી સદીમંદું અંગ્રેજો જિક સંસ્કૃતિને પ્રભાવ હેઠળ ચુરોપમાં સાહિત્ય, તત્ત્વજ્ઞાન આ ક્ષેત્રોમાં પર સ્પર સમાંતરતા અને ક્ષયારેક એકુઝપતાની દર્શાન થવા માંડયાં. ઈટમી સદીની શરાબાતથી જ ઈટાનું અને જર્મન ૨૧૦૫માં સાહિત્ય બિશે કુટૂંબ જગ્યાત થયું.

વ્હેન્ય લિદુખી મેડમ સેટ્લે (madam staal) જર્મનીએ સંસ્કૃતિ વિકાસમાં રચ લીધો, અને તેના લેખથી જ તુલનાત્મક સાહિત્ય વિશારનો ચુરોપમાં શુલાસુલ થયો એમ માનવામાં આવે હે. આજે પણ

તુલનાં ત્મક સાહિત્યને હાનિમાં મહત્વનું સ્થાન અપાય છે.

જરૂર કુલિ ચુઠથેનું, પોતાના ૨૧૭૫ સિલાય બીજ ૨૧૭૬ના સાહિત્યનું પણ વાપારની એમ આદત-પ્રદાન થઈ નેછે, એમ માત્રનું હતું. એમનો આદર્શ વિશેવસાહિત્યનો હતો.

અહીં સાહી પહેલાં "વિશેવ સાહિત્ય" વિશે સમજ્યે. વિશેવ સાહિત્ય વિશે વાત કરવાની એ રીત છે: ચુઠથેની અને રવી જનાથની. ૧૯૮૩ સાદીના મૂલીર્ધમાં ચુરોપ જગત વિજેતા બનવા ની કણ્ણું હતું, ને અંકમંડળિતા અંકોના ઈતરજન તરફ એ રીતે જુઓ તે રીતે નેવા વિવશ હતું. કુલિ ચુઠથે આડિ વિધ્યાનો પેલી અહૂકારી અને અત્યારી સંસ્કૃતિને, ઘણલી નહોતા રાકતા; અંદર એનો પ્રાણુપણે વિરોધ પણ નહોતા કરતા. એટલે ચુરોપ બહાર રહેતી માણસનાં ને કાંઈ સર્જન કર્યું હતું, એના પ્રત્યે આદરસાંબથી જ નહીં; કંયારેક "સ્વપ્નિલ" ભાવથી નેતાનું તુલનાં ત્મક સાહિત્ય સ્વપ્નિલ ન અને, તે પહેલી શરત છે. હેચ પણ એટલેન હિર્ફાર, સાહિત્યના તુલનાં ત્મક અભ્યાસ માટે એ વસ્તુ જરૂરી ગણે છે. "ઉન્ય રાંકોન્સ રેખાલ" એટલે કે "વાસ્તવિક સંપર્કી" અને એ વડે સર્જયેલું "ઉન્ય દેપાંડિંસ" એટલે કે "અવલંબન" સાંભળની લાખા, એક, વાસ્તવિક સંપર્કની વીગતો અપ્યવાની લાખા, બીજ. તુલનાં ત્મક સાહિત્યનો આલેખ આ બીજ લાખામાં ચાલે.^૨

રને વેલેકું ચુઠથેની આ "વિશેવ સાહિત્ય" ની વિભાવનાને
પોતાની રીતે બેતા હતા. "He was thinking of a single unified world literature in which differences between the individual literature would disappear, though he knew that it would be quite remote"
૨૨

(એટલે કે લ્યારે ઝેમાં વૈચ કિર્ક, (લાખા વિરોધ) નાં સાહિત્યો એમાં રખી જરો એવા એકમાત્ર અને સંયુક્ત વિશેવસાહિત્યનું હે (ચુઠથે)
વિભાવન કરતા હતા. - એ કે એ જણાતા હતા કે આ ચંકયતા વણી વેગળી હતી)" - એનું વેલેકું નહોંદે છે.
૨૩

બીજ લાખ પ્રો. પ્રોવર લખે છે: "એકથી વધુ લાખાની

સાહિત્યકુટિના વૈષણ્વ, સાધ્ય, પ્રલાવ કે પ્રલાવનું સંશોધન કુટેલું
વિદેશન એટલે તુલનાં ત્યક્ત સાહિત્યાભ્યાસ."³ પ્રો. પ્રોવર ચ્યુઈથેની વિરીવ સાહિત્યની વિભાવનાને મહત્વની ગણે છે. તે લખે છે :

"weltliterature in Goethe's sense, is clearly related to comparative literature and may lead comparatists to ask many of their most interesting questions".

પણ ચ્યુઈથેની વિભાવનાને, અમના સમયના યુરોપના જગતના બીજાને દેશને સાથેના સંબંધને વૈતિષાસિક, રીતે સમજ્યા વિના, સાહિત્યના તુલનાં ત્યક્ત અભ્યાસના ભૂમાં મૂક્કલાથી મુર્કેલીઓ હાલી થવાનો સંસાર છે.

બીજુ ૫૧૫, ૨વી જ્ઞાનાથ ટાગોર " યત્ર વિશ્વમાં ભવત્યૈકનીડમ્" આર્દ્ધાથી પ્રેરાય છે. જગતના સાહિત્યમાં જે કોઈ વિભૂતિમાટે તેનો અભ્યાસ રાજ્યવાદના સંકુચિત વર્તુળમાંથી નીકું જઈને કુરવો એ અમને અલિપ્રેત છે. આ બલણ અમે વિરીવની પ્રશ્નાં ?
સાહિત્યકુટિઓ માટેનું રેમનું આકૃષણ રેમને એક વ્યાપકતા તરફ લઈ નથે છે.

આપણે ત્યાં "વિરીવસાહિત્ય" ને "તુલનાં ત્યક્ત સાહિત્ય"
સાથે સાંકુળબાનું બલણ, છે. અન્ય સંસ્કૃતિયાની "મહાન" કુટિઓની
સરખામેણી ગુજરાતી કુટિઓ સાથે કુરવાની આપણે ત્યાં પ્રથા છે. પણ
અને સમજવા માટેનાં સાધનાનું વડતર કરતી વખતે અન્યાંત સાધધાન
રહેણું નેઇએ. એ નોંધમાં રહેણું છે.

તુલનાં ત્યક્ત સાહિત્યની વ્યાપ્તિઓ આપવાના ધણા
પ્રથાસો થયા છે, એદુંબળું. બેંડલરે તુલનાં ત્યક્ત સાહિત્યનાં લક્ષણો
અતાવતાં કુણ્ણું છે.: "A conception involving a method a conception
of literature as a whole, a conception of this whole as
composed of national elements a conception of literature as
distinguished from linguistics".

હેઠી રેમાંક "એક સાહિત્યની બીજ સાહિત્ય અથવા

બેદુથી બધારે સાહિત્ય સાથે કુરેલી તુલના એટલે તુલના ત્યક્ત સાહિત્ય" અમ માને છે, તે ઉપરાંત "બીજ માનવીય આવિજ્ઞારોના વિદોક્ષેપન। જીદલે કુરેલો સાહિત્યનો અભ્યાસ એટલે સાહિત્યનો તુલના ત્યક્ત અભ્યાસ" અમ પણ તે માને છે.

અહીં એક પ્રસન જગે છે. એક ૨૧૦૫ના સાહિત્યની બીજ ૨૧૦૫ના સાહિત્ય સાથેની તુલના તો બરાબર, પરંતુ તેમાં માનવી જીનશાખાનો ઉલ્લેખ કરવો જરૂરી છે ?

જ્યાં - મારી કારે તુલના ત્યક્ત સાહિત્યને "સાહિત્યના ઇલ્લિલાસની બેદુથીખા" ઇથે જુથે છે, સાહિત્યનો ઇલ્લિલાસ "સાહિત્ય" - નો ઇલ્લિલાસ છે, ઇલ્લિલાસ માટેનું સાહિત્ય ખૂબ પોડાનું વધાણ નહીં.

આમ, તુલના ત્યક્ત સાહિત્ય એક ધિક ભાષાની આખાદી સાહિત્ય કુતિઓની આ આદેશનું સ્વાચ્છતાને ગોળાયેલી અને સાથે એ પ્રત્યેકું કુતિના પોતાના અને એ કુતિસમૂહના સહિતારા જીદલને પ્રસ્તુત કરતી અભ્યાસ પ્રક્રિયાનું નામ છે.

આ રીતે નેતાં, તુલના ત્યક્ત સાહિત્યના હૈન્ય અલિગમ અને અંતરિક્ષન અલિગમ એ બે અલિગમ બેબા મળો છે.

[] હૈન્ય અલિગમ પ્રમાણે Comparative literature is the study of literature beyond the confines of one language.

કોઈપણ એક લાખાના સીમાઓખાંથી મુક્ત થઈને ઘરાં સાહિત્યનો અભ્યાસ ચુરોપીય વિચારકોને મળે તુલના ત્યક્ત સાહિત્ય કહેવાય. શરત એટલી કે જેની તુલના થાય છે તેવાં વટકો બચ્ચે વાસ્તવમાં ઐલિલાસિકું રીતે પુરવાર થઈ શકે તેવાં સંપર્ક વટે, અને

Actual contact ની સંતો અપાઈ છે, પરા, ડાયરીઓ, અનુવાદ, આત્મકથા, સ્મૃતિબિક્રો વગેરે Actual contacts ના માધ્યમ હોઈ શકે છે. ઓં બધાનીયાંબા સંપર્કનાં અંતરિક્ષ પ્રમાણો ગણી શક્યાય.

અહીં આપણે જેથું કે હૈન્ય અલિગમ સાહિત્યના ઇલ્લિલાસનો પહોંચા કરે છે. કેટલાંક હૈન્ય વિદ્વાનીમાં હિસ્ટ રિચ્યાન્ડીના

દેખાણાં પુરુષ, લોહ, મુદ્રા - ૧૧૧૦

અગ્રહોનો અતિરેક પણ નેવા માં છે. વાતાળેન શ્રીજીના સાહિત્યના - આપણા
તુલનાંથી અભ્યાસ માટે "વાસ્તવિક સંપર્ક" અને "અવલંઘન" ને અનિવાર્ય
ગણે છે. જેની આપણે ઉપર ચચ્ચે કરી. વાતાળીગરેમ "આપડું/સામાન્ય
સાહિત્ય" એટલે કે "જનરલ વિટરેશર" ની વિભાગના સાથે તુલનાંથી
અભ્યાસને સાંકળી છે, એ ભાવાઓનાં સાહિત્યની પારસ્પરિકતાનો
અભ્યાસ તે તુલનાંથી સાહિત્ય, જ્યારે બેઠી બધારે ભાવાનાં સાહિત્યનો
-ને સાંકળી હુકીકતોનો અભ્યાસ તે સામાન્ય સાહિત્ય. આર. શે. સ્ટેચસ
આપડું સાહિત્યને સાહિત્ય પદર્થના અભ્યાસ સાથે બેંકરાય ગણે છે,
નેમાં ભાવાના સીમાંથી અવગણાય છે.

બીજી તરફ, તુલનાંથી સાહિત્યમાં "રાધ્રીય સાહિત્ય"ની
વિભાગના એમને માટે મહત્વની જને છે. રાધ્રીય સાહિત્યની
પારસ્પરિકતાનો અભ્યાસ તે તુલનાંથી સાહિત્યનું રાધ્રીય સાહિત્ય
-ની વિભાગનાંથી માટે એ ભાવાઓના સાહિત્ય પર થતું કેન્દ્રીકરણ
સાહિત્યના ઈતિહાસને એ અભ્યાસના પાયામાં મુક્કી આપે અને ઈતિહાસ
લેખનના પ્રભાગને તુલનાંથી સાહિત્યના આલેખના/ ડિસ્કોર્સના પ્રભાગ
સ્પર્ધપણે સાંકળી આપે. ૬.

આપણે લાં ગુજરાતી- હિન્દી નબલિકા। પરંપરાઓમાં જુદે
જુદે તથફુકે આવા વિભિન્ન ભાગો સાથે તેમજ પ્રોચ્ચિન ભારતીય કુથા
સાહિત્ય વિભિન્ન વિષાંકો સાથે નેવા માં છે. વળી પંગાળી નબલિકા।
પરંપરા સાથે પણ બન્નેનો ઈતિહાસિક સંપર્ક ખરો, તુલનાંથી અધ્યયન
ના સર્વે પ્રલાભક સંપર્કોનું આકૃતિન પણ તાકે છે. ગુજરાતી અને હિન્દી
ના ભાગે વાતરીંકુલાઓનું પર સ્પર્ધ તુલનાંથી અધ્યયનની આવા જુહે
તુલનાંથી અધ્યયનના ભાગને અણી પ્રસ્તુત છે.

તુલનાંથી સાહિત્ય અધ્યયનનો બીજો વિસ્તાર અપેરિકાની
વિધાપીઠોમાં વિકસાવાયેલો, રે સાહિત્યનું અન્ય વિધાશાસાંઓનું
જુહે જુહેઓનું થતું અધ્યયન. મરો. ડેરિ લેવિન તુલનાંથી સાહિત્ય
માટે "વાસ્તવિક સંપર્કો" નો અહેવાલ બનવા તરફ ન છો માટે
સાહિત્યના ઈતિહાસમાં ઝૂલિના વાસ્તવાના મહિમાને આગળ કરે છે.

દેવિતન। પરે તુલનાટ્યક સાહિત્યની શક્તિ આવે છે from its way of looking at all literature a one organic process a continuous and cumulative whole," exponentium છે.

"the organic totality of literature itself"

એના પર જારી મૂકે છે.¹⁰

કૃસિરેર બીજો જુદા અલિગમો પામવા માટે Symbolic Form ની સર્જા થાપે છે. પણેવી અલિવ્યક્તિ myth ની છે, પણે religion ની, પુરાણાની અને ધર્મની જાથે જાથે જાપાણ પણ વડાણા માંડી. સમાજ રચના થતાં ૨૧૫ની લિસાસ્ક, અર્થિસાસ્ક, દર્શિનિસાસ્ક, મનોવિજ્ઞાન, ભૌતિકવિજ્ઞાન એમ જુદાં જુદાં પાસાં આપણી સમજ આત્મતાં ગયાં અને એ દ્વારા માત્રા અન્તિનો વિકાસ થવા માંડયો અને તે તુલનાટ્યક અધ્યયન માટે પણ મદ્દદિય થઈ પડે છે. આ પદ્ધામાં સાહિત્ય અને કુલા એ માત્રાના અનુભવની સહી પ્રથમ અલિવ્યક્તિ હોય.

દેખી રેમાડિ, વ્યુટન, સોફ્ટકોર્ટ જેવાં અપેરિટ્યુન વિદ્વાન્ઓ
—એ બતાવ્યું કે comparative literature is the study of literature on one hand and on the other hand another discipline of human learning.....

કહીએ તો Comparative literature is the study of literature in its wider context.... - વૃદ્ધ જીવનમાં થતો સાહિત્યનો અભ્યાસ. એટલે હવે તુલનાટ્યક સાહિત્ય એટલે સાહિત્ય ફુલિયોની સર્વાંગી સ્થાયત્વાના અનુભવનો આત્મિ - આત્મિય.

આપણે ત્યાં આ અલિગમ વધુ જેવા માં છે. મધુરાયની ફેટલી કુલાલિકાઓના આકુલન્યાં મનોવિજ્ઞાનની લેખકની સૂત્ર જાવકે પણ કુંઈક ઝોલાવી પડે. ગુલાયદાસ પ્રોક્રિયાની જ્યંત ઘણીની ફેટલી કુટલી કુટલી જીતમ ફુલિયોમાં પણ આ પરિમાણ જેવા માં, બીજી તરફ ઉંડાયાદી વિશુરણાઓનો પરિચય સુંદરમું, પ્રેમગંડ અને યશપાવા જેવા સર્જાને સમજવામાં ઉપયોગી થાય. જિંદરેફની અને અરોથની વાતાઓમાંથી

કેટલીએ તો વિલક્ષણપણે મનોવિજ્ઞાન પણે પહોંચી જય છે, અને એ પણ વાતાંકવાનો ભોગ લીધા ક્રિના, બદ્લે એને વધારે વેદાંક બનાબીને, ને કે આવો જુહુ સુદર્શન કુયારેકું કુલાંધી સિંદ્રાદના ખલા ઉપર વિચાર રૂપી પણ્ણળો વૃદ્ધ્ય સંબંધ થઈ ગયો હોય એવો ય લાગે. આપણે આપણાં પ્રકૃતણોના તુલના ત્યકું અલ્યાસમાં આ બંને શક્યતાઓને પણ તપાસીશું.

ગુજરાતી સાહિત્યની તેમ જ છિન્દી સાહિત્યની તુલના, એ અંકું પ્રેબાંડ, ગુજરાતી - છિન્દી સર્જફોની નવ લિકાયોનો અર્થકારણ, ૨૧૪કારણ, સમાજ વિદ્યા આ હિ શિસ્તબ્ધ્ય વિચારણાઓના સર્દલીમાં અલ્યાસ, એ બીજે પ્રેબાંડ, આપણે આ શોધ નિષ્ઠાંદ્યમાં આ બંને પ્રેબાંદોનો સમાબેશ કરતી તુલના ત્યકું પદ્ધતિનો વિનિયોગ કરવા ધાર્યો છે, એ પદ્ધતિમૂલક સ્પૃષ્ટતા વાસ્તે જ કરવી યોગ્ય છે.

x + x + x + x

संदर्भ शूलि.

१. तौलनिक साहित्याभ्यास - वसंत बापट
२. तुलनात्मक साहित्य - डॉ. सितारंगु थशश्चयंद - विवेचना।
विविध अलिंगभौ - ज्ञ. विनायक रावत अने अन्य。
३. Prof. S.S.Prawer -Comparative literary studies: An Introduction.
४. F.W.Chandler - Comparative studies
५. Discriminations - RENE WELLECK
६. तुलनात्मक साहित्य - डॉ. सितारंगु थशश्चयंद -
विवेचना। विविध अलिंगभौ - ज्ञ. विनायक रावत अने अन्य。
७. देविन - कोनेपररी कुटिसिंग्स.

x + x + x + x

21/2
21/2
21/2
21/2
21/2
21/2
21/2